

SHANTAI INDUSTRIES LIMITED

CIN: L46411GJ1988PLC013255

Reg Office: Shop 10 2nd Floor, Agrasen Point, Nr Agrasen Bhavan, Citylight Road, Bharthana, Surat, Gujarat, 395007
Website: www.shantaiindustrieslimited.com, Email-id: shantaiindustriesltd@gmail.com, Tel: 0261-2211212

Date: 06/02/2026

To,

BSE LIMITED

Phiroze Jeejeebhoy towers,
Dalal Street,
Mumbai- 400 001.

Scrip ID/Code/ISIN : SHANTAI/512297/INE408F01024
Subject : Intimation of Newspaper Advertisement of Extract of Standalone Unaudited Financial Results for the quarter and nine months ended on 31st December, 2025
Reference No. : Regulation 30 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

We wish to inform that pursuant to Regulation 30 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of Extract of Standalone Unaudited Financial Result for the quarter and nine months ended on 31st December, 2025 published in Newspapers on Thursday, 05th February, 2026.

1. English Daily: "Free Press Gujarat" dated 06th February, 2026.
2. Regional Language Daily: "Lokmitra" dated 06th February, 2026.

You are requested to kindly take the same on record.

Yours Faithfully,
Thanking you
For Shantai Industries Limited

SHIPRA MEHTA
Company Secretary and Compliance Officer

Place: Surat

Encl: Copy of Newspaper

Amazon MX Player Unveils the Trailer of Its Upcoming Courtroom Drama

Ahmedabad, Amazon MX Player, India's leading free, premium, ad-supported video streaming service, today unveiled the trailer of its upcoming original series *Amar Vishwas*, a gripping courtroom drama that dives deep into the intersection of power, crime, and justice. Headlined by Rajeev Khandelwal in the titular role, alongside Ravi Behl, Aamir Ali and Barkha Bish, the series sets the stage for a high-stakes courtroom battle where truth is where truth is elusive and justice comes at a steep price. The trailer opens with the brutal murder of an influential film producer Jessu Momin, a case the media is quick to label as 'open-and-shut'. Suspicion immediately falls on Bahar Chakravarty, a young woman already convicted by public perception. Stepping into the fray is Amar Vishwas, an unconventional and razor-



sharp lawyer who knows that facts alone rarely reveal the full story. As Amar takes on Bahar's defence, he begins to uncover layers of exploitation, manipulation, and long-buried secrets, revealing a conspiracy that runs deeper and darker than it first appears. Based on the acclaimed novels by Suhas Shirvalkar, *Amar Vishwas* is created and produced by Arjun Singh Baran and Karthik D Nishandar under the banner of GSEAMS, makers of highly acclaimed show, *Samantha*. *Amar Vishwas* blends the intensity of courtroom drama with the grit of investigative crime.

Highlight India's Evolving Health-Conscious Consumer Landscape

Ahmedabad, Vitafoods India 2026, the nation's premier exhibition for nutraceuticals and dietary supplements, is scheduled to take place from February 11-13 at the Jio World Convention Centre in Mumbai. This landmark event is expected to draw over 10,000 industry professionals and more than 200 domestic and international exhibitors, creating a massive networking hub for the entire health and nutrition value chain. With a focus on personalized nutrition, clean-label products, and science-backed formulations, the expo will feature industry giants like KSM-66® Ashwagandha and Akums Drugs. A robust content program, including the



Plan was to keep the reveal of the first female villain: Mallika Prasad

Ahmedabad, Mallika Prasad aka 'Amma', the first female villain in the hit *Mardaani* franchise, has become a huge talking point of *Mardaani* 3, given her magnetic, bone-chilling on-screen impact! The acclaimed actor reveals how Yash Raj Films built the strategy to keep her under wraps pre-release for her character to have maximum impact on screen for the audience! Mallika says, "There's always a lot of joy in the movies whenever there is a big reveal or there is a surprise. The *Mardaani* franchise has excelled at creating great villains, so with the character of Amma this was the plan - to keep things under wraps until the timing was right for the surprise reveal of the first female villain of the franchise." YRF's thought was that if Mallika is put forward in pre-release promotions, people will get to see more of her.



MobiKwik turns PAT profitable in Q3 FY26

Ahmedabad, One MobiKwik Systems Ltd. (MobiKwik) (NSE: MOBIKWI / BSE: 544305), India's largest digital wallet[2], today announced its earnings results (standalone and consolidated) for the quarter ended December 31, 2025. The Company reported a profitable quarter, underpinned by strong execution across its Payments and Financial Services businesses. This marks a significant inflection point as MobiKwik transitions to profitability while continuing to scale its platform & strengthens its role in enabling digital financial access across Bharat. The improvement across these metrics reflects a complete recovery in the Lending business. With profitability firmly re-established, the Company is well positioned to accelerate

growth across its digital financial services portfolio in a calibrated and sustainable manner. Commenting on the Company's performance, Upasana Taku, Executive Director, Co-founder and CFO, MobiKwik, said: "We are pleased to report a profitable quarter, reflecting disciplined execution and sustained cost optimization across our businesses. Our focus on operating efficiency and thoughtful scaling has enabled us to achieve profitability while maintaining growth momentum. We were confident of achieving profitability in H2 FY26, and we are proud to have delivered on that commitment. Going ahead, we remain committed to scaling our platform responsibly and creating long-term value for our shareholders."

Printed and Published by MAYUR PUBLICATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chamber, Nr. Fadia Chamber, Ashram Road, Ahmedabad-Published From KALYANI PUBLICATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakali rly crossing, mithakali, ahmedabad. Editor : Mayur C. Bhatt

Ahmedabad press release pink power walkathon



Ahmedabad, In a significant step towards strengthening cancer awareness and early detection, HCG Aastha Cancer Centre, Sola, organised the Pink Power Walkathon - "Step Up. Speak Out." on the occasion of World Cancer Day. The initiative aimed to educate the community about cancer prevention, promote early screening, and encourage open conversations around cancer. On the morning of World Cancer Day, HCG Aastha Cancer Centre (HACC) successfully commenced the Pink Power Walkathon with

the enthusiastic participation of 220 women, spreading cancer awareness and inspiring the community towards a healthier future. The walkathon witnessed large-scale participation from oncologists, healthcare professionals, cancer survivors, patients, caregivers, volunteers, and members of the public, all united by a shared mission to spread awareness that early diagnosis can save lives. Participants carried the message of hope, resilience, and timely action while advocating for routine health check-ups. (20-4)

Asian Granito India Posts Robust 9MFY26 Net Profit of ₹43.83 Crore

Ahmedabad, Asian Granito India Limited (AGL), one of the largest Luxury Surfaces and Bathware Solutions brands in the country, reported a 10.60% rise in consolidated net sales at ₹1,219.10 Crore for the nine months ended period ended December 2025 compared to ₹1,102.24 Crore in the corresponding period previous year. The strong performance was backed by higher sales due to buoyant demand and operational efficiency. During this period, the company reported a net Profit of ₹43.83 Crore compared to a loss of ₹4.97 Crore. While EBITDA of ₹102.34 Crore, up 134.43% Yo-Yo. Meanwhile, for December 2025 quarter (Q3FY26), the company reported a consolidated net sales growth of 15.80% at ₹423.93 Crore as against ₹366.09 Crore in the corresponding period previous year. Net profit during

this period grew to ₹20.07 Crore compared with a loss of ₹4.53 Crore in the same period last year. EBITDA margin expanded 603 bps to 9.62% and EBITDA grew 210.21% to ₹40.80 Crore backed by operational efficiency. The Company reported 336.25% rise in standalone net profit at ₹4.42 Crore for Q3FY26 on revenues of ₹268.42 Crore. EBITDA was at ₹7.91 crore against a loss of ₹1.61 Crore. For 9MFY26, revenues were at ₹800.48 Crore and net profit was at ₹17.39 Crore. (18-2)

Apollo Tyres Ups the Ante with their new Ad Campaign

Ahmedabad, Apollo Tyres, the Lead Sponsor of the Indian Cricket Team, today announced the launch of its new brand campaign, 'Har Safar Mein Dum Hai'. Featuring cricket icon Sachin Tendulkar alongside Team India cricketers Virat Kohli, Rohit Sharma, KL Rahul, Shubman Gill and Arshdeep Singh in official Team India jerseys, the campaign is anchored by a deeply emotional brand film that celebrates Indian cricket's enduring spirit and its commonality with the ethos at Apollo Tyres. Udayan Ghai, Group Head, Marketing, Apollo Tyres Ltd, said "the campaign is a strong articulation of Apollo Tyres' brand philosophy, reinforcing its positioning around performance, endurance and reliability across its product portfolio. Drawing parallels with Indian cricket's journey from India to the world, the film reflects

Apollo Tyres' own evolution as a global brand while strengthening its emotional connection with consumers." Speaking about the film, Devajit Saikia, Secretary, The Board of Control for Cricket in India (BCCI), said, "This film authentically captures the spirit of Indian cricket. It reflects the hard work, sacrifice and endurance required to represent the country at the highest level. The BCCI is proud to partner with Apollo Tyres, a brand that understands the importance of nurturing talent and celebrating the journey from grassroots ambition to world class mastery." (19-10)

TAFE Launches 'MASSEY DYNASTAR Contest' Season 3

Ahmedabad, Building on two highly successful seasons that celebrated grassroots ingenuity and rural entrepreneurship, TAFE - Tractors and Farm Equipment Limited, one of the world's largest tractor manufacturers and the maker of India's iconic Massey Ferguson tractors, today announced the launch of Season 3 of the 'MASSEY DYNASTAR Contest 2026 - #Sabse Bade Allrounder Ki Talaash'. TAFE's MASSEY DYNASTAR Season 3, the biggest edition yet, is envisioned as a national innovation platform designed to empower farmers, entrepreneurs, students, startups, and rural changemakers. Celebrated for its progressive approach in recognizing and nurturing new ideas in agriculture and rural entrepreneurship, the MASSEY DYNASTAR Contest



serves as an online platform for farmers, entrepreneurs, students, academicians, and innovators with original concepts that can create meaningful impact using Massey Ferguson tractors. Season 3 expands its scope by inviting ideas powered by any Massey Ferguson tractor unlocking limitless possibilities across agriculture, allied sectors, and rural enterprises, with exciting rewards and greater opportunities for participants to showcase their creativity on a national stage. (18-2)

PLASTINDIA 2026 INDIA'S LARGEST PLASTIC EXHIBITION

Ahmedabad, The Six-day PLASTINDIA 2026, India's largest plastics exhibition, is being organised by the Plastindia Foundation, the apex body representing leading associations, organisations and institutions of the Indian plastics industry will begin in New Delhi tomorrow from February 5-10, 2026. PLASTINDIA 2026, the leading international plastics exhibition and India's first-ever 100% zero-waste expo will be hosting over 2,000 exhibitors and expects to attract more than 6 lakh footfall from India and across the world, showcasing the scale, strength and global competitiveness of the Indian plastics industry. "PLASTINDIA 2026 to be unveiled by Delhi Chief Minister Mrs Rekha Gupta will host a series of high-impact initiatives designed to strengthen policy

dialogue, global trade and sustainability. These include a CEO Conclave, bringing together industry leaders and policymakers, and a Reverse Buyer Seller Meet (RBSM) that will facilitate structured one-to-one meetings between Indian exhibitors and international buyers, accelerating exports and long-term business collaborations." Said Mr Kamath, "India's plastics industry is witnessing strong and sustained growth. The market, currently valued at USD 26.5 billion in 2025, is projected to reach USD 44.5 billion by 2030, growing at a CAGR of 11%. Plastics exports are expected to double from USD 10 billion in 2025 to USD 20 billion by 2027, reaffirming India's expanding role in the global plastics value chain," said Mr. Kamath. (1-7)

Statement from Kia India Private Limited on Union Budget 2026-27



Ahmedabad, "The Union Budget 2026-27 sets out a clear and forward-looking path for sustained economic growth, with a strong focus on manufacturing, infrastructure and fiscal discipline. Continued investments in roads, railways, freight corridors and regional connectivity, along with the development of new economic regions and high-speed corridors, will open up fresh opportunities and support balanced growth across the country. The emphasis on advanced manufacturing, electronics and battery production, rare earth corridors and MSME empowerment strengthens India's journey towards becoming a competitive global manufacturing hub under the vision of

Atmanirbhar Bharat. Together, these measures reinforce consumer confidence and accelerate the transition towards technology-led and sustainable mobility. As India progresses towards a Viskit Bharat, Kia India looks forward to contributing meaningfully to this transformation through future-ready mobility solutions." (1-7)

The Donroe doctrine: How Trump's Venezuela strike redefines US policy

On January 3, 2026, the Trump administration launched Operation Absolute Resolve, a surprise military raid in Caracas that resulted in the capture and abduction of Venezuelan President Nicolás Maduro and his wife, Cilia Flores, to the United States. The long-term effects of Trump's operation raise concerns for global peace because they undermine international law and norms, risk escalating regional instability, and signal a shift towards a "might is right" international order.

Several factors signal a shift toward neo-imperialism. Among these is the resurrection of the Monroe Doctrine, which was enunciated in 1823. This Doctrine essentially closed the Western Hemisphere to European control and asserted American influence over it. It warned European powers against further interference in the Americas, stating the US would stay out of European conflicts in return. The US administration has explicitly cited a "Trump Corollary" to the 1823 Monroe Doctrine to justify its expansion of military presence in the Western Hemisphere. In fact, Trump has renamed the Monroe Doctrine the "Donroe Doctrine" after the Venezuela raid.

Following months of escalating pressure, US special forces (including Delta Force and the 160th SOAR) conducted a "smash-and-grab" raid on January 3, 2026, capturing Maduro. At least 80

people were reportedly killed during the strikes. Maduro was brought to the Metropolitan Detention Centre in Brooklyn to face charges of narco-terrorism and drug trafficking. The Trump administration claimed Venezuela posed an "imminent threat" by allegedly co-ordinating with groups like Hezbollah and foreign adversaries to pump drugs and weapons into the US.

President Trump declared the US would "run" Venezuela for an unspecified transition period. However, Secretary of State Marco Rubio later clarified that the US would not govern but would use a "quarantine" oil embargo to coerce the remaining leaders. Trump also stated the US would seize control of Venezuela's oil reserves—the

world's largest—to "reimburse" the US for damages and allow American oil companies to refurbish the infrastructure. The operation has sparked considerable opposition in the US as it was launched without congressional briefing or international mandate, which legal experts describe as a "grave precedent" and "naked imperialism". Democratic Party leaders, such as Hakeem Jeffries, labelled the operation an "unconstitutional act of war", arguing that such large-scale military actions require congressional authorisation under the War Powers Act.

President Trump argued he had the "inherent constitutional authority" to order the strike without prior congressional approval.

CERA SANITARYWARE LIMITED

REG. OFFICE: 9, GIDC Industrial Estate, Dist. Mehsana, Kadi, Gujarat, 382715

Notice is hereby given that the certificate(s) in respect of below mentioned Equity shares of the Company has / have been lost / misplaced / stolen and the holder(s) of the said shares has / have applied to the company for issue of Duplicate share Certificate(s) in lieu of the original share certificate(s).

Name of Shareholder Folio No. Certificate No. Distinctive Nos. No. of Shares
N V V N M MURALI RAO CSL00005625 9534 395687 - 3956786 100
16329 7341891 - 7341990 100

Any person, who has a claim in respect of the said shares, should lodge such claim with the Company at its Registered Office within 15 days from publication of this notice, failing which the Company will proceed to issue duplicate share certificate(s) without further intimation.

Place: Nidamanuru - Residence Date: 06-02-2026

Name of the Claimant
Shridevi Nagalla

MEHTA INTEGRATED FINANCE LIMITED

CIN: L65910GJ1985PLC007692

Reg. Off: 003, Law Garden Apartment, Scheme-1, Law Garden, Ellisbridge, Ahmedabad - 380006
E-mail: 1mifl_in@gmail.com • Website: www.mehtaintegratedfinance.com • Phone: +91 9377578519

Extract of Statement of Standalone Un-audited Financial Results for the Quarter and Nine Months Ended 31/12/2025

(Rs. In Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter ended 31.12.2025 (Unaudited)	Nine Months ended 31.12.2025	Quarter ended 31.12.2024 (Unaudited)
1	Total Income	4.52	58.48	28.45
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional and Extraordinary items)	(14.04)	8.42	10.37
3	Net Profit/(Loss) for the period before tax (after exceptional and Extraordinary items)	(14.04)	8.42	10.37
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and Extraordinary items)	(14.04)	8.42	10.37
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period after tax]	(14.04)	8.42	10.37
6	Equity Share Capital (Face Value o Rs. 10/- each)	500.00	500.00	500.00
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-
8	Earnings per share (before and after extra ordinary items)	-0.28	0.17	0.21
	Basic & Diluted			

Notes:

- The above is an extract of the detailed format of Unaudited Financial Results filled with the Stock Exchange under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the websites of the Stock Exchange: www.bseindia.com and on the Company's website: www.mehtaintegratedfinance.com
- The above Unaudited Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on February 05, 2026.



For, Mehta Integrated Finance Limited
Sd/-
Vishwesh D. Mehta
Managing Director
(DIN: 00484785)

SHANTAI INDUSTRIES LIMITED

CIN: L46411GJ1988PLC013255

Reg Office: Shop 10 2nd Floor, Agrasen Point, Nr Agrasen Bhavan, Citylight Road, Bharthana, Surat, Gujarat, 395007
Website: www.shantaiindustrieslimited.com, Email-id: shantaiindustriesltd@gmail.com, Tel: 0261-2211212

The Standalone Unaudited Financial Results for the quarter and nine months ended 31st December, 2025 have been filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Unaudited Financial Results for the said period is available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at https://shantaiindustrieslimited.com/quarterly-reports/

The Standalone Unaudited Financial Results for the quarter and nine months ended 31st December, 2025 have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on 05th February, 2026



For Shantai Industries Limited
Sd/-
Vasudev Fatandas Sawlani
Wholetime Director
DIN: 00831830

Date: 05-02-2026
Place: Surat

